



નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ

પરિપત્ર નં. ૨૯-A તા. ૧૯-૦૬-૨૦૨૩

ફક્ત મ્યુનિ. શાળાઓ માટે :-

વિષય:- ૨૧ મી જૂન આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા બાબત.

સંદર્ભ :- (૧) નિયામકશ્રી, પ્રા.શિ., ગુ.રા., ગાંધીનગરના પત્ર ક્રમાંક : પ્રાશિનિ/છ-૨/સંકલન/
૨૦૨૩/ ૨૦૫૨-૧૪૦ તા.૦૮-૦૬-૨૦૨૩

(૨) ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,
ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પરિપત્ર ક્રમાંક: ગયબ/IDY/ઉજવણી/૨૦૨૩,
તા. ૧૨/૦૬/૨૦૨૩

આથી તમામ મ્યુનિ. શાળાઓના મુખ્ય શિક્ષકોને ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, તદ્દનુસાર વર્ષ ૨૦૧૫ થી પ્રતિ વર્ષ ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. ચાલુ વર્ષે “ આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ૨૧ મી જૂન ૨૦૨૩ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોજવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા G-20 ની One Earth, One Health ની થીમને ધ્યાનમાં રાખતા આ વર્ષે “ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” ના નારા સાથે “ વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” અને “હર ઘરના આંગણે યોગ” ના થીમ સાથે ૨૧મી જૂન-૨૦૨૩ ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાની થાય છે.

તા.૨૧ જૂન-૨૦૨૩ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારના તથા અ.મ્યુ.કો.ના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઈવેન્ટ ગ્રાઉન્ડ, રિવરફ્રન્ટ, પાલડી ખાતે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩”ની ઉજવણી થનાર છે. અત્રેથી જે તે ઝોનના અધિકારી દ્વારા આપવામાં આવેલ સુચના મુજબના શિક્ષકોને કાર્યક્રમના સ્થળે સવારે ૫-૩૦ કલાકે સ્કૂલ બોર્ડને ફાળવેલ જગ્યા પર ઉપસ્થિત રહેવા જાણ કરશો.

સાબરમતી વિધાનસભા વિસ્તારમાં પશ્ચિમ ઝોનના મદદનીશ શાસનાધિકારી દ્વારા આયોજન મુજબ કાર્યક્રમો યોજવાના રહેશે જેની અલગથી સુચના આપવામાં આવેલ છે, જ્યારે બાકીની શાળાઓએ તા. ૨૧ જૂન-૨૦૨૩ના રોજ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩” અંતર્ગત તમામ મ્યુનિ. શાળાઓમાં જ શાળાકક્ષાએ જ ઉજવણી કરવાની રહેશે. શાળાના ધો.૫ થી ૮ના તમામ વિદ્યાર્થીઓએ યોગ કરવાના છે. તમારી શાળાના શિક્ષકે શાળામાં કોમન યોગ પ્રોટોકોલ મુજબ જ યોગ કરાવવાના છે. જ્યાં અ.મ્યુ.કો.ના ઝોન કક્ષાના કાર્યક્રમો શાળામાં યોજવામાં આવનાર હોય ત્યાં પુરેપુરો સહકાર આપી સાથે કાર્યક્રમ કરવાનો રહેશે.

તા. ૧૯-૦૬-૨૦૨૩

ડૉ.એલ.ડી.દેસાઈ
શાસનાધિકારી